

રાણીપર ટાઉન પ્લાનરશી સુ. શ. વિ. આપ મંડળના
કુટુંબ નં. સડા / વિ. પ. અ. ૧૪૭૧/૮૮૬૬-લીપા-૮૭૬૫ | ૧૦

These removed the
validity of this
permission expires
on 12/11/2118

२०११
२०११
Singapore
भारत-सिंह नगर नियोजक
भारत-सिंह विद्यालय सन्तान भवन,
भारत.

REVISED PLAN

This revised plan supercedes the earlier plans sanctioned vide this office order No. SUDA/DPA/164/8896


5330

at 27/09/2017

which are hereby cancelled.

— WALL UP TO .90 MT HT.

WALL UP TO .90 MT HT.

0.60 wide elevation
box treatment

TYPICAL FLOOR PLAN
(1ST & 4TH)

A - BLDG

TYPICAL FLOOR PLAN
(1ST & 4TH)

B - BLDG

Shop	Shop No.	Capital	No. of Amen Shop	TOTAL
	107	485	1	485
	102 TO 119	2324	18	41832
	320	4639	1	4639
	121 TO 125	2324	5	11620
	126	6216	1	6216
	127	6231	1	6231
	128 TO 133	5920	6	35320
	134	14245	1	14245
	135	5212	1	5212
	136	16544	1	16544
	137	17294	1	17294
	138	13557	1	13557
	139	2110	1	2110
	140	4725	1	4725
	141	3800	1	3800
	142,143,144,145	17111	3	51333
	143	1415	1	1415
	146	5727	1	5727
	TOTAL	47		144450

GR FL. + 14 to 4th
TOTAL = 165335 + 57720 = 741155 SHRT.

144450 X 4 = 577200 SHRT.

SANITARY CALCULATION:-

REQUIRED URINAL
 7441.13 / 100 person = 1462.30 person (lay 1463 person)
 5 gram

REQUIRED W.C.
 5471.33 / 100 person = 54.71 person (lay 55 person)
 = SAY 1385 up to 100 person - 54 (140 person)
 = 22 REQUIRED
 22.76 person (11385 person)

USE

	Fritzen Required		Proposed	
	Female	Male	Female	Male
CCMMA	Urinal	22	10	25
	Water	22	10	20
	Ceased	10	10	20

NOTE:-
 1. 5 gram
 2. 100 person 820 person - 10 (810 person)
 = SAY 1700 person - 1463 person (lay 1463 person)
 = 220 REQUIRED
 100 person - 183 (81 person)
 = 20 REQUIRED

COLOR NOTES	
Proposed Work Show In	
Approach Road Show In	
Plot Boundary Show In	
Drainage Line Show In	
C.O.D. Show In	

SCHEDULE OF OPENING		
particular	size	no.
ROOLING SHUTTER R.S.	4.88 X 3.21	1
Door	1.22 X 2.10	2
Door	0.84 X 2.10	3
WINDOW	1.98 X 3.67	4
WINDOW	5.12 X 2.47	W-1

OWNER SIGNATURE	ARCHITECT & PLANNER	ARCHITECT SIGNATURE
 J. Daniels PROJECT MANAGER Partner	Sanyal Jodha & Associates 1000 West 12th Avenue CA 92015 19025 Registered Architect T.D.O. / A/E / I/S Architects & Interior Designer 201.202 - RITZ SQUARE, First Floor, Near Indoor Stadium, Ghod Dood Road, SURABT - 353007 Tel : (026)1266770/990 e-mail : info@sjacshi.com	

Tel : (0261)2666770/990
e-mail - todros@sjosshi.com

સાહેબજીને મળે એટલે જીવનમાં આજીવન સુખ મળે છે. આજીવન સુખ મળે એટલે જીવનમાં આજીવન સુખ મળે છે.

Development permission is granted subject to the condition that it shall be the responsibility of the applicant and his Architect / Engineer / Surveyor / Structural designer, to follow the relevant I. S. Specification in structural design to ensure safety of the buildings, and as just structural designs are not verified.

REVISED PLAN

This revised plan supercedes the earlier plans sanctioned vide this, office order No. SUDA/ DPA / 174/8836

5330 at 23/09/2012


which are hereby cancelled.

Entries removed the
 validity of a "false
 termination" applies
 to all "false" entries



લીનીયર ટાઈમ પ્લાનટબ્લી શુ. વિ. સંતા મંગળપા
 ક્રમ નં. ગુણ / વિ. પ. અકલોતિ-૨૧૫, રાજીવ
 11 2 DEC 2017 - ડી. એચ. જી. આર્.
 સી. એચ. ટાઈમ પ્લાન્ટ
 ગુણ મંગળપા રાજીવ સંતા મંગળપા
 ગુણ.

(Faint handwritten notes)



TERRACE FLOOR PLAN
scale :- 1.00 cm. = 1.00 mt.

TERRACE FLOOR PLAN
scale :- 1.00 cm. = 1.00 mt.

OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	
OWNER SIGNATURE		ARCHITECT SIGNATURE	

REVERSED LOW RISE COMMERCIAL BLDG. PLANNON BLOCK NO. 126, PAM SUB DIVISION NO. B, MOJE - KARADIA TAL., GHORVARI, DIST. SURAT.

SHEET NO. = 09
A & B - BLDG
BUILT UP & F.S.I.
AREA CALC.


આવકારી નીચેના મુજબ સુધારા કરવામાં આવેલ છે. આ દસ્તાવેજ માત્ર માહિતી માટે છે અને કાયદાકીય અસર નથી. કૃપા કરીને નોંધ લેવા.

સુધારા કરવામાં આવેલ છે. આ દસ્તાવેજ માત્ર માહિતી માટે છે અને કાયદાકીય અસર નથી. કૃપા કરીને નોંધ લેવા.

Development permission is granted subject to the condition that it shall be the responsibility of the applicant and his Architect/Engineer/Surveyor/Structural designer, to follow the relevant L.R. Specification in structural design to ensure safety of the buildings, and as per structural design, are not verified.


આવકારી નીચેના મુજબ સુધારા કરવામાં આવેલ છે. આ દસ્તાવેજ માત્ર માહિતી માટે છે અને કાયદાકીય અસર નથી. કૃપા કરીને નોંધ લેવા.

સુધારા કરવામાં આવેલ છે. આ દસ્તાવેજ માત્ર માહિતી માટે છે અને કાયદાકીય અસર નથી. કૃપા કરીને નોંધ લેવા.




BUILT UP F.S.I. CALC.
Scale :- 1.00 cm. = 1.00 mt.

A - BLDG



BUILT UP F.S.I. CALC.
Scale :- 1.00 cm. = 1.00 mt.

B - BLDG



OWNER SIGNATURE
R. K. Kevadia
For: Manjiv Developers
Partner

ARCHITECT & PLANNER
Sanjay Joshi & Associates
Council of Architecture
CA / 2005 / 36025
Registered Architect
T.D.O. / AN / 158
Architect & Interior Designer
201/202 - RTZ SQUARE,
2nd Floor, Near Indoor Stadium,
Ghod Dod Road, SURAT - 395007
Tel : (0261) 256670/990
e-mail : sdhro@sanjayjoshi.com

ARCHITECT SIGNATURE
Sanjay Joshi